



પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય



આણંદ કૃષિ યુનિવર્સિટી,

આણંદ-૩૮૮૦૦૧

પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, આણંદ ખાતે યોજાયેલ 'વન હેલ્થ એપ્રોચ ફોર કંટ્રોલ ઓફ રેબીઝ ઇન ઈન્ડિયા' નો એક દિવસીય પરિસંવાદ

આણંદ કૃષિ યુનિવર્સિટી સંલગ્ન પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય અને પ્રમુખ સ્વામી મેડીકલ કોલેજ, કરમસદ એવં એસોસિયેશન ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ રેબીઝ ઇન ઈન્ડિયા (APCRI), બેંગાલુરુનાં સહયોગથી 'વન હેલ્થ એપ્રોચ ફોર કંટ્રોલ ઓફ રેબીઝ ઇન ઈન્ડિયા' નો એક દિવસીય પરિસંવાદ કપિલા સેમિનાર હોલ ખાતે તા.૦૬/૧૦/૨૦૧૮ નાં રોજ યોજાયેલ હતો. પરિસંવાદનાં પ્રારંભમાં પ્રાર્થનાગીત એવં દિપ પ્રાગટ્ય પછી મહાનુભાવોનું પુષ્પ ગુચ્છ તથા સ્મૃતિચિહ્નથી સ્વાગત કર્યા પછી મહાવિદ્યાલયનાં ઇન ચાર્જ ડીનશ્રી ડો. બી. પી. જોષીએ આણંદ કૃષિ યુનિવર્સિટીનાં માનનીય કુલપતિશ્રી ડો. એન. સી. પટેલ સાહેબ, મહાવિદ્યાલયનાં ડીનશ્રી ડો. એ. એમ. ઠાકર એવં ગુજરાત રાજ્યનાં પશુપાલન નિયામકશ્રી ડો. એ. જી. કાછિયા પટેલ દ્વારા પાઠવેલ શુભેચ્છા સંદેશનું પઠન કર્યા પછી ઉપસ્થિત વૈજ્ઞાનિકો સમક્ષ મહાવિદ્યાલયનાં શિક્ષણ, સંશોધન અને વિસ્તરણની પ્રગતિનો વિસ્તૃત ચિતાર આપેલ હતો. સમારંભનાં પ્રમુખસ્થાને બિરાજેલ આણંદ યુનિવર્સિટીનાં સંશોધન અને અનુસ્નાતક વડાશ્રી ડો. કે.બી. કથીરીયા સાહેબે માનવીય આરોગ્ય એવં પશુઆરોગ્ય સાથે સંકળાયેલ હડકવાનાં રોગ વિશે થયેલ સંશોધનો માટે વૈજ્ઞાનિકોને બિરદાવી, આ ક્ષેત્રે વધુને વધુ સહયોગી સંશોધનો માટે પ્રોત્સાહિત કરેલ હતાં. તેઓશ્રીએ સાથોસાથ મહાવિદ્યાલયનાં સંશોધનોની વિગતવાર માહિતી પણ આપેલ હતી. મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત પ્રમુખ સ્વામી મેડીકલ કોલેજનાં ડીનશ્રી ડો. હિમાંશુ પંડ્યાએ માનવીય આરોગ્ય માટે ખતરારૂપ હડકવાનાં રોગ વિશે રસપ્રદ માહિતી આપી, તેમનાં તબીબો તથા મહાવિદ્યાલયનાં વૈજ્ઞાનિકો દ્વારા આ ક્ષેત્રે થયેલાં સંશોધનો માટે સઘળાની સરાહના કરેલ હતી. અતિથિ વિશેષશ્રી તરીકે ઉપસ્થિત ડો. ડી. એચ. અશ્વથનારાયણ, પ્રેસિડેન્ટ, એપીસીઆરઇ, બેંગાલુરુએ સંસ્થા દ્વારા હડકવાનાં પૂર્વોપાય અંતર્ગતની વર્ષપર્યંત થયેલ વિવિધ પ્રવૃત્તિઓનું દ્રષ્ટિઆલેખન કરી ઊડાણભરી સમજણ આપેલ હતી. આણંદ કૃષિ યુનિવર્સિટીનાં સહસંશોધન નિયામકશ્રી ડો. એમ.કે. ઝાલાએ પરિસંવાદ ને અનુરૂપ હડકવા નાં રોગ ને નાથવા માટેનાં લેવામાં આવેલ વૈજ્ઞાનિક પગલાં અને માનવીય એવં પશુસંરક્ષણ માટેનાં પૂર્વોપાયની તબક્કાવાર વિશદ ઝાંખી કરાવેલ હતી. તેઓશ્રી એ મહાવિદ્યાલયનાં વૈજ્ઞાનિકોશ્રી, અધિકારીશ્રીઓ એવં તબીબીગણોને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા બદલ અભિનંદન પાઠવી પરિસંવાદની આભાર વિધિ કરેલ હતી. પરિસંવાદમાં

હડકવાનાં રોગને નાથવા માટેનાં વિવિધ માર્ગદર્શિય સંશોધનો અંગેનાં પ્રવચનો પણ રજૂ કરવામાં આવેલ હતા. પરિસંવાદનું સફળ સંચાલન ડો.એમ.ટી. પંચાલ, પ્રાધ્યાપક, ગાયનેકોલોજી દ્વારા કરવામાં આવેલ હતું. સમારંભની પૂર્ણાહુતિ રાષ્ટ્રગીત સાથે થયેલ હતી.

